

3rd February, 2026

To,
Department of Corporate Services
BSE Limited
25th Floor, P. J. Towers,
Dalal Street,
Mumbai – 400 001

To,
Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block G, Bandra Kurla
Complex, Bandra (E),
Mumbai - 400 051

Security Code: 540923

Security Symbol: ASHOKAMET

Dear Sir/Madam,

Sub: Submission of Newspaper Advertisement for Postal Ballot of the Company

Pursuant to Regulation 30 and 47 of the SEBI Listing Obligations and Disclosure Requirements, Regulations, 2015, please find enclosed herewith copies of the newspaper advertisement published on 3rd February, 2026, confirming completion of dispatch of Notice of Postal Ballot through email and providing other necessary information published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Kindly take the same on your record.

Thanking You.

Yours faithfully,

For Ashoka Metcast Limited

Ashok C. Shah
Managing Director
DIN: 02467830



Encl: As above

Ashoka Metcast Limited

Reg. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads,
Mithakhali Ahmedabad 380006. **Website:** www.ashokametcast.in
Email : info@ashokametcast.in **CIN :** L70101GJ2009PLC057642 **T :** 079 26463226

મહીસાગરમાં વાતાવરણમાં પલટો

સંદેશ: વૃક્ષો ઉગાડો, ઓકિસજન બચાવો

A man is riding a bicycle on a city street. He is wearing a blue and green patterned t-shirt, a black long-sleeved shirt underneath, and a white bib with the number 5404. A pig is sitting on his back. He is holding a white sign that reads "STOP AIR POLLUTION FIT INDIA". The background shows a city street with buildings and a bridge.

દરેક મેસેરોનામાં ભાગ લઈ લાગભગ
સંદેશ અચરજમાં રીતે ફેલાવી રહ્યા
છે. શશીકાંત પાંગાએ કહ્યું, “વાવુ
મૂઢપૂઢ અને વૃશ્ણાના અંધાપૂંધ કાપ
સામે લોકોમાં જાગૃતિ લાવવાના
મારો નોતરો પ્રયાસ છે. જો પ્રકૃતિ
બચશે તો જ આપણે બચીશું. આજે
પાણિતિ એવી છે કે આપણે બજારમાં
સાચી પીરીદીએ છીએ; ભવિષ્યમાં
કંઠાય હવા (ઓકસિજન) પણ
પીરીદવી પડે. વ્યક્તિગત વાહનોના
વસ્ત્રા ઉપયોગથી ટ્રાફિક અને મૂઢપૂઢ
અને વધી રહ્યા છે, તેથી જાહેર
પરિવહન અને સાયકલિંગને
પ્રોત્સાહન આપવું જરૂરી છે.”

ઓડિશામાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા શશીકાંત પાંડા ૨૦૧૭થી વડોદરામાં એક ફાર્મસી કંપનીમાં કાર્યરત છે. કોવિડ-૧૯ દરમિયાન આવેલા સ્વાસ્થ્ય સંકટો તેમને આ પર્યાવરણલક્ષી પહેલ શરૂ કરવા માટે પ્રેર્યા, જેને તેઓ સતત આગળ વધારી રહ્યા છે.

સૈધાંતિક અને પ્રાયોગિક માહિતી આપી હતી તથા જુદા જુદા પ્રકારના મશરૂમની જાત અને તેની ઉપયોગીતા અને કાષ્ઠક વિશેની સંસ્કૃતિ સ્પષ્ટિત છણાવટ કરી હતી. ઘઉંના ભુંસાના ઉપયોગ કરીને મેથડ ડોમેસ્ટેશનના માધ્યમથી તાલીમાર્થીઓ પાસે જ મશરૂમ તૈયાર કરવાની પદ્ધતિની શીખવેલી હતી. આ તાલીમથી સૌંદભવાણ, વાંજવડ, સામરવરણી, દમણ, રાયા, રૂઢવાણ, કાકડોપર, વલસાડ, બીલીમોરા, વલવાણ, ગાડારીયા, ભાનવડ, પાનસ, તરમાલિયા, ડુમલાવ, પરિયા, આંબા જંગલ, પંચલાઈ, નીલાશી અનેંબેટી અને કરજીના ગામનાં ૪૮ થી વધુ તાલીમાર્થીઓ ભાગમાં અને નોંંબેટી અને ભાગ લીધો હતો. દરેકકે તાલીમાર્થીને નિર્દેશન પેટે બિયારણ, પ્લાસ્ટિક બેગ, ફોરમેલીન, કાર્બનડીઝીમ પાવડર આપવામાં આવ્યું હતું.

લાઈબ્રેરી રૂ.૭૦ કરોડના ખર્ચે કતારગામમાં તેયાર થઈ રહી છે, જેનું લોકાર્પણ આચારી ત્રણ મહિનામાં થશે. આ લાઈબ્રેરી જાઓ પુણનાના ઉદ્ભવળ બવિધ્ય કંડારશે. ડભોલી વિસ્તારમાં નવનિર્મિત ઓડિટોરિયમ કતારગામ, વરાછા અને આસપાસના વિસ્તારોના યુવાનો, ક્ષેત્રોમાંથી આવેલા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. નાનપુરગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ-વરાછા અને સંજીવકુમાર સ્મૃતિ-લાઈબ્રેરીના નવા દિશા મળશે કતારગામમાં પણ આધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થવાથી સુરત શહેરમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે એમ મહાનગરપાલિકા સોર ડ્રેજીના ઉપયોગથી દર વર્ષે અંદાજે રૂ. ૧૦ કરોડની બચત કરી રહી છે. જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં દ્રષ્ટાંતરૂપ કદમ છે એમ જણાવી શ્રી સંઘવીએ કહ્યું કે, સરદાર દ્વારા નિર્મિત ઓડિટોરિયમ, બ્રિજ, લાઈબ્રેરી અને શાળાઓ જેવા નવા પ્રોજેક્ટો, વિકાસપ્રકલ્પો માત્ર આજ માટે નહીં, પરંતુ આવનારી પેઢીના બવિધ્ય માટે ઉભા કરાવે છે. આ સંપત્તિઓની રક્ષા, સંચાળ, જાળવણી અને સ્વચ્છ રાખવા એ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ

ARKA

अरका किन्डेप लिमिटेड

रजिस्टर्ड ऑफिस : २४०४, २४०५, २४०६, २४०७ भाग, ओई बोझा प्लेस,
बोझा वर्ल्ड टावर, सेनापति हाउस मार्ग, बोलन रोड, मुंबई - ४०००१९
CIN: U65993MH2018PLC308329
टेलीफोन नंदा २२ ४०४९१०००
वेबसाइट: www.ar kafincap.com
ईमेल: customercare@ar kafincap.com

सुचना - शाखा स्थणारत

आ दारा सुचना आपवानमां आवा छे के अरका किन्डेप लिमिटेड तेनी हालामा स्थित शाखा ओकिंस
माइलवरीन ठहिये, ओकिंस नंभ ०-४०८, पभा माण, गुजरात सभागवार पाये, उधना दरवाजा, सिंग रोड,
सुरन, गुजरात - ३८५००२, जे प २०२४ ती अवसलमां युकीने स्थणारत करवाना प्रस्ताव मुके छै.
क्रॉपिंग सहाय माद, कृषा कर्मीन + ८९ २२ ४०४९१००० पर संपर्क करी अथवा
grievanceredressal@ar kafincap.com पर ईमेलछ मोड़वी

तारीख : २४ डेकुआरी, २०२४
स्थणः मुंबई

**अरका किन्डेप लिमिटेड भाटे
सक्षी/
निरी मेहता**

कंपनी सेक्टर ई अने बीछ इम्प्लायर्स ओकिंसर

A Kirloskar Group Company

The mark "Kirloskar" in the status in line is owned by Kirloskar Proprietary Limited
and ARKA Finance Limited is the permitted user.

[illegible]

અશોક મેટાકસ્ટ લિમીટેડ

CIN: L70101GJ2009PLC057642

રજીસ્ટર્ડ ઓફિસ : સાતમે માળ, અશોક ચેમ્બર્સ, મીડાપોલીઝ જ રસ્તા, અમદાવાદ - ૩૮૦૦૦૬.

ફોન નં. ૦૭૯-૨૬૪૬૨૨૨૬, Email ID : info@ashokmetacast.in, Website : www.ashokmetacast.in

પોસ્ટલ બેલેટ અને ઈ-વોટીંગની માહિતીની સુચના

સૂચના આથી આપવામાં આવે છે કે કંપનીનો એક્ટ, ૨૦૧૩ (“અધિનિયમ”) ની કક્ષમ ૧૦૮, ૧૧૦ અને અથવા લાગુ જોગવાઈઓ જાહેરાતોઓ, જે કોઈ હોય તો કંપનીની (મેનેજમેન્ટ એન્ડ એગ્રીનિટુંડેશન) નિયમો, ૨૦૧૪ (“નિયમો”) ના નિયમ ૨૦ અને ૨૨ સાથે વાંચવા માટે, તેઓ (જોગવાઈઓ અથવા નિયમો) સહિત તે સમય માટે અમલમાં છે, અને તે અનુસાર કોર્પોરેટ રેગ્યુલેશન, ૨૦૧૫ (“હિસ્ટ્રીંગ રેગ્યુલેશન”) કોર્પોરેટ વેપારિક ફેરાર (ઓ) અથવા તેના પુનઃઅધિનિયમ (ઓ) સહિત તે સમય માટે અમલમાં છે, અને તે અનુસાર કોર્પોરેટ બાયોતોના મંત્રાલય (“એમસીઆર”) દ્વારા જારી કરવામાં આવેલા પરિણામો (ન્યારબલ સામુહિક રીટ) “એમસીઆર પરિણામ” તરીકે ઓળખાય છે, તેવીના નિયમન ૪૪ દર્શાવે છે-ઈ-વોટીંગ દ્વારા પોસ્ટલ બેલેટ કરવા માટે કોર્પોરેટ બાયોતોના મંત્રાલય દ્વારા નિર્ધારિત માનકાંદિકા માંગદંદિકા સાથે સેવા (હિસ્ટ્રીંગ ઓથોરિટીસ એન્ડ રિસ્કોલોર રિસ્કમાનેમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ (“હિસ્ટ્રીંગ રેગ્યુલેશન”), સેક્ટરીટીંગ સ્ટાન્ડર્ડ - ૨ (“એસ.એસ. - ૨”), ઈન્ટરન્યુટ એન્ડ કંપની સેક્ટરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે અને અનુસાર કાનૂનીય અને નિયમો, જે કોઈ હોય તો, નીચે સુજન સેટ કરેલ વ્યવસાય રિમોટ ઈ-વોટીંગ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા કંપનીના સભ્યોની મંજૂરી માંગવામાં આવે છે :-

ક્રમ નં.	સામાન્ય કસ્ટમર વર્ણન
૧.	શ્રી કુંજન નાથભાઈ શાહોડની (ડીઆઇએન : ૧૦૮૬૪૭૦૧) કંપની ના નોન - એક્ટિવક્યુટરી ઈ-પીપેસડ ડાયરેક્ટર ની એવર્ડમેન્ટ ને રેગ્યુલેટરોન કરવા માટે
૨.	મેમોરેન્ડમ ઓફ એસોસીએશનમાં ઓછુંકટને દાખલ કરવા માટે

કંપનીએ ૨૬ જુલાઈ, ૨૦૨૨ ના રોજ પોસ્ટલ બેલેટ નીતીસ ના તમામ સભ્યોને ઉમેલ દ્વારા મોકલી છે કે જેમણે કંપની અથવા વિપોસ્ટરીટી / ડિપોસ્ટરીટી સહભાગીઓ સાથે તેમના ઉમેલ સરનામાં રજીસ્ટર કર્યા છે અને જેમના નામ ક્યુટર, ઓન, જાન્યુઆરી ૨૦૨૨ સુધી કંપનીના સભ્યોના રજીસ્ટરમાં અથવા વિપોસ્ટરીટી દ્વારા જાળવવામાં આવેલા બાલકરી માલિકોના રજીસ્ટરમાં દાખલ થાય છે.

સભ્યો નોંધ લે કે આ સૂચના કંપનીની વેબસાઈટ : www.ashokmetacast.in પર, બીએસઈ ની વેબસાઈટ : www.bseindia.com, એનએસઈઈ ની વેબસાઈટ : www.nseindia.com અને સીએસએસઈ ની વેબસાઈટ : www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. એમસીઆર પેપરના નોંધ પાસનામાં આ પોસ્ટલ બેલેટ માટે ખુલાસાનમ નિવેદન સાથે નીચેની નીતી બોલિત નક્કર મોકલવામાં આવી હતી.

રિમોટ ઈ-વોટીંગ સમયગાળા મંજૂરવા, ૨૬ જુલાઈ ૨૦૨૨ (૮:૦૦ સવારે) ના રોજ શરૂ થશે અને બુધવાર, ૪મી માર્ચ, ૨૦૨૬ (૫:૦૦ સાંજે) (બંને દિવસો સહિત) ના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, ક્યુટર, ઓન, જાન્યુઆરી ૨૦૨૨ ને ૮ - કોઈ - તારીખ (ટૂંકોટ તારીખ) મુજબ કંપનીના ગેરકાર્યના દિવસો જેઓ ઉબેક્ટરીટી રીટ નીચેના મત આપી શકે છે. ન્યારબલ મતદારોના રિમોટ ઈ-વોટીંગ માટે અનુમતિ આપવામાં આવશે.

પોસ્ટલ બેલેટ નીતીના ભાગરૂપે ઈ-વોટીંગ માટે વિગતવાર સૂચનાઓનો સંદર્ભ લેવામાં આવેલો વિનંતી કરવામાં આવે છે. ઉબેક્ટરીટી કાનૂનીય મતદાર કરવાની સુવિધા સાથે જોડાયેલો નામ કરીદાઓ શ્રી રામકેશ દલવી, સિતિપરમાર સેતુલ (સીડીએસએલ) સેતુલ (સીડીએસએલ) (ઈ-પીઆ) લિમીટેડ, એન્ડ. વિંગ, ૨૫મો માળ, મેરેનાના કુયરકર, મકાનલાલ સિદ્ધાંત કાંકર અને અન્ય જોશી માંડ, લોયર પર્લવ, પુલ્ક, મુંબઈ - ૪૦૦૦૪૩ પર સંબોધવામાં આવી શકે છે અથવા helppdesk.evoting@cdsindia.com પર ઉમેલ મોકલો અથવા લેલક નંબર ૧૮૦૦ ૨૧૦૮૮૧૧ પર સંપર્ક કરો.


શ્રી વિમન કે. પટેલ, અમદાવાદ ના પ્રેક્ટિસીંગ કંપની સેક્ટરીટી, નિયમજન અને પારદર્શક રીતે રિમોટ ઈ-વોટીંગ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ બેલેટનું સંચાલન કરવા માટે સ્કુટીનોડાઉન તરીકે નિયમજન કરવામાં આવેલ છે.

પોસ્ટલ બેલેટનું પૂર્વિણામ ક્યુટર, ૬મી માર્ચ, ૨૦૨૬ ના રોજ અમલમાં તે પહેલાં કંપનીના ચેરમેન અથવા અન્ય કોર્પોરેટર અથવા અન્ય અધિકૃત વ્યક્તિ દ્વારા જાહેર કરવામાં આવશે, તે સ્ટોક એક્સચેન્જને જાણ કરવામાં આવશે અને કંપનીની વેબસાઈટ : www.ashokmetacast.in પર પણ અનુમતિ કરવામાં આવશે.

જે સભ્યોનો અન્યાર કંપની તેમને તેમની સરનામાં રજીસ્ટર કરાહી પૂરી, અથવા તેમના ઉમેલ આવી ઇમેલ આવી શકે છે, તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના રિમોટ ઈ-વોટીંગ સહભાગીઓ સાથે તેમની ઇમેલ કરો, જેથી તેમના સરનામ સેક્ટરીટી રીટ પ્રાપ્ત થઈ શકે.

**સાથેના મેટાકસ્ટ લિમીટેડ,
લોક ઓફ કિરેકટરની આધેશીટી,
સહી/-
સાથેના ચીફનુમર્ડા શાહ
મેનેજીંગ ડીરેક્ટર,
DIN: 02467330**

તારીખ : ૨૬ જુલાઈ
તારીખ : ૦૨.૦૨.૨૦૨૬



બ્રાન્ચ ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેંક લિ. ઓફિસ નંબર ૨૦૧, ૨જો માળ, રોડ નં. ૧, પ્લોટ નં. બી.૩, વાલેડાઈ આઈટી પાર્ક, વાલેડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ) - ૪૦૦૦૧૪.

સિક્યુરાઈઝેશન રિફરંક્રેશન કાર્ડનાન્સ એસેટ ઍનડ ઍનકોર્પોરેટેડ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યુરિટી ઇન્ટરેસ્ટ ઍન્કોર્પોરેટ ૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે સહી કરનાર આઈસીઆઈસીઆઈ બેંકના સત્તાવાર અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપ્યાથી ૬૦ દિવસની અંદર અહીં દર્શાવેલા નાણા ભરી જવા જણાવવામાં આવે છે.

કરજદારો તથા યુક્તવવામાં નિષ્ફળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહીં જણાવેલી મિલ્કતનો રૂબરૂ વર્ધ લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલ્કત તંચમાં હોય કરજદારો અને સામાન્ય જનતાએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં.


ક્રમ	કરજદારોનું નામ / લોન એકાઉન્ટ નંબર	મિલ્કતની વિગત / ભૌતિક કબજાની તારીખ	દિમાં નોટીસની તારીખ / (દિમાં નોટીસની સમય રૂ)	શાખાનું નામ
૧.	શિવ કુમાર / રૂઝા શિવ કુમાર LBSUR00005472559	આના તમામ ભોગ અને હિસ્સોએ ઓફ સ્થાવર રેસીડેન્સીયલ મિલકત જેનો જમીન સેલેક્ટ્રેશન માપ ૬૬.૮૦ ચોરસ મી. (અવિભાજિત જમીન સેલેક્ટ્રેશન માપ, ૩૮.૦૦ ચોરસ મી.) જે પ્લોટ નં. ૩૫૮ અને વિસ્તાર સાઈ વાલ્ટિકાર-હાઉસ નીકેટ ઓળખાણ જેનો રેવેન્યુ નંબર નં. ૧૯૮, ૧૯૮, ૨૦૦ અને ૨૧૩ (બ્લોક નં. ૧૯૧ પૈકી ૧) લોકેટેડ અંદર આના: બેનુમારા, સખા-ડિસ્ટ્રિક્ટ: પલસાણા અને ડિસ્ટ્રિક્ટ: સુરત યુજાત ૩૯૫૦૦૬- રાજ્યમાં સ્થિત છે -૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૬	૨૦ માર્ચ, ૨૦૨૪ રૂ. ૧૪,૮૨,૮૪૦.૮૮/-	સુરત

(ઉપર જણાવેલા કરજદાર(રો)/ જમીનમાલ(રો)અહીં બાકી નાણાં પસંદ કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવે છે. નહીં તો કલમ ૮ અને ૮ જણાવેલી ઇન્ટરેસ્ટ (ઇન્કોસ્ટેસ્ટ) રૂબ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જમીન તેસીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે.

૨૦૨૬ નં. ૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૬

સ્થાન: સુરત.

નિષ્ણાપૂર્વક અધિકૃત અધિકારી,
આઈસીઆઈસીઆઈ બેંક લિ.વતી

<div>  <div> ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ (અગાઉ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિ.) </div> </div>			
<p>રજીસ્ટર્ડ ઓફિસ : શ્રીનિવાસ ટાવર, પહેલો માળ, ટુન નં. ૫, જુનો નં. ૧૧, બીજી લેન, સેનાનોડક રોડ, અલવરપેટ, ટેમ્પાએટ, ચેન્નાઈ-૬૦૦૦૧૮.</p> <p>ટેડ ઓફિસ : લેવલ ૩, વોકહાટ ટાવર, પૂર્વ વિંગ, સી-૨ બ્લોક, બાન્દ્રા-કુરલા કોમ્પ્લેક્સ, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૫૧. વેબસાઈટ : http://www.truhomefinance.in</p>			
<p>આપી સુચના આપવામાં આવે છે કે નીચેના દેવાદારોએ ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ (અગાઉ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિ.) પાસેથી મેળવેલી લોન સુવિધાઓના નિર્ધારિત વક્કા અને વ્યાજની ચુકવણીમાં કોઈક થાણા છો અને ઉપરોક્ત લોન માળખાને નોન-પરફોર્મિંગ એન્ટ્રેડ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમને તેમના છેલ્લા જાણીતા ચરખામાં પર સિક્યોરાઈઝેશન અને ટી-સ્ટ્રક્ચરના અંક કાપનાવવાના એવરેડ અને એનોમીનમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરવેલ, ૨૦૦૨ (સરચાર્જ નો કલમ ૧૩(૨) હેઠળ પ્રીમાન્સ નોટીસ જારી કરવામાં આવી હતી. એવરેડ અને એનોમીનમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરવેલ, ૨૦૦૨ (સરચાર્જ નો કલમ ૧૩(૨) હેઠળ મોકલવામાં આવેલી ઉપારકતઓ, સિકેટરીટીઝ, બાકી લેણાં, પ્રીમાન્સ નોટીસ અને તેમના હેઠળ ચોક્કસ રકમની વિવરતો નીચે મુજબ આપવામાં આવી છે.</p>			
<div> <div> ધિયારકર્તાઓ અને સહ-ધિયારકર્તા / જામીનદારોનાં નામ </div> </div>	<div> <div> મુકદ્દર મિલકતનું વર્ણન </div> </div>	<div> <div> પ્રીમાન્સ નોટીસની તારીખ અને બાકી હોંદી રકમ </div> </div>	
<p>લોન એકાઉન્ટ નં. SHLHVDDR00000834 & SHLHVDDR00000835 (ધિયારકર્તા નં. ૧) અને (૨). વીણા સાયનાથ (ધિયારકર્તા નં. ૨), બધાનું સરનામું :- ૨અ/૩૦૬, (સરચાર્જ એપાર્ટમેન્ટ, એસર પેટ્રોલ પંપની પાસે, તરસાલી, વોડોરા, ગુજરાત - ૩૮૦૦૦૮. અને અહીં પાસે : ગુરુનાનાંક ૩પો સ્ટોર, દુકાન નં. એસ ૨-૮, નંનનન કોમ્પ્લેક્સ, સુસેન રીંગ રોડ, તરસાલી, વોડોરા, ગુજરાત - ૩૮૦૦૦૮.</p> <p>કલેટ નં. ૧ :- કલેટ નં. ઈ-૧૦૨ અને કલેટ નં. ઈ-૧૦૩, પહેલો માળ, ટાવર - ૧, મલખાર વેલી, પુષ્કર રામલાલઈની નામે, શાંતની ની બાજુમાં, આંગ વિશ્વાલ રોડની પાસે, તરસાલી, વોડોરા, ગુજરાત - ૩૮૦૦૦૮.</p> <p>Loan Amount - Rs. 16,77,287/- LAN - SHLHVDDR00000835 NPA Date : 03-10-2025 Loan Amount - Rs. 17,77,875/- LAN - SHLHVDDR00000834 NPA Date : 03-10-2025</p>	<p>મિલકત નં. ૧ :- બીન ખેતીલાયક જમીન પરનો પ્લોટ, મોજે - તરસાલી, વોડોરા, જમીનોનો આર.એસ. નં. ૪/૨૨, ભેતકળ ૧૦૮૨૫ સ્કે.મી., ટીપી સ્કીમ નં. ૩૮, એકપી નં. ૨/૫૨, ભેતકળ ૩૮.૩૦૦ સ્કે.મી., મલખાર વેલી, ટાવર - બી, પહેલો માળ, કલેટ નં. ૧૦૨, કાપેટ એરીયાનું ભેતકળ ૪૭.૩૮ સ્કે.મી., બાદકની વોસ એરીયાનું ભેતકળ ૪.૮૦ સ્કે.મી., કુલ કાપેટ એરીયાનું ભેતકળ ૫૨.૧૮ સ્કે.મી., અવિભાજીત હક્ક સાથેની જમીનનું ભેતકળ ૧૨.૮૨ સ્કે.મી., સુપર બિલ્ડ અપ એરીયાનું ભેતકળ ૮૧.૦૩ સ્કે.મી. એટલે કે ૮૭૯.૫૦ સ્કે. ફીટ., રજીસ્ટ્રેશન અને સમ જાણીતા - વોડોરા, જલ્લો - વોડોરા, રાજ્ય - ગુજરાત, ચતુ-સીમા :- ઉત્તરે :- ૧૮.૦૦ મી. ટીપી રોડ, દક્ષિણ :- કલેટ નં. ઈ-૧૦૧, પૂર્વ :- કલેટ નં. ઈ-૧૦૩, પશ્ચિમે :- ૧૬ મી. ટીપી રોડ.</p> <p>મિલકત નં. ૨ :- બીન ખેતીલાયક જમીન પરનો પ્લોટ, મોજે - તરસાલી, વોડોરા, જમીનોનો આર.એસ. નં. ૪/૨૨, ભેતકળ ૧૦૮૨૫ સ્કે.મી., ટીપી સ્કીમ નં. ૩૮, એકપી નં. ૨/૫૨, ભેતકળ ૩૮.૩૦૦ સ્કે.મી., મલખાર વેલી, ટાવર - બી, પહેલો માળ, કલેટ નં. ૧૦૩, કાપેટ એરીયાનું ભેતકળ ૪૪.૩૫ સ્કે.મી., બાદકની વોસ એરીયાનું ભેતકળ ૭.૪૭ સ્કે.મી., કુલ કાપેટ એરીયાનું ભેતકળ ૪૭.૮૨ સ્કે.મી., અવિભાજીત હક્ક સાથેની જમીનનું ભેતકળ ૧૨.૮૨ સ્કે.મી., સુપર બિલ્ડ અપ એરીયાનું ભેતકળ ૮૧.૦૩ સ્કે.મી. એટલે કે ૮૭૯.૫૦ સ્કે. ફીટ., રજીસ્ટ્રેશન અને સમ જાણીતા - વોડોરા, જલ્લો - વોડોરા, રાજ્ય - ગુજરાત, ચતુ-સીમા :- ઉત્તરે :- ૧૮.૦૦ મી. ટીપી રોડ, દક્ષિણ :- કલેટ નં. ઈ-૧૦૪, પૂર્વ :- સોસાપટી રોડ, પશ્ચિમે :- કલેટ નં. ઈ-૧૦૨.</p>	<p>પ્રીમાન્સ નોટીસની તારીખ : ૨૮/૦૧/૨૦૨૬</p> <p>પ્રીમાન્સ નોટીસની રકમ (રૂ. ૧૬,૮૭,૮૭૩/- (રૂ. અઠાર લાખ ઓગણસતર હજાર તેતાલીસ પુરા), ૨૧/૦૧/૨૦૨૬ ના સુધી, બીન એકાઉન્ટ નં. SHLHVDDR00000835 કા રૂ. ૧૬,૭૭,૮૨૭/- (રૂ. ઓગણસતર લાખ સત્યાવીસ હજાર આઠસો સત્યાવીસ પુરા) તા. ૨૧/૦૧/૨૦૨૬, બીન એકાઉન્ટ નં. SHLHVDDR00000834 યકત વ્યાજ, આકસ્મિક બચાઓ અને કોસ્ટ વગેરે સાથે.</p>	
<p>લોન એકાઉન્ટ નં. SHLHBRUH00000181 (૧). વસાવા હંસોબીન રાહુલકુમાર (ધિયારકર્તા નં. ૧) અને (૨). વસાવા રાહુલકુમાર સોમાભાઈ (ધિયારકર્તા નં. ૨), બધાનું સરનામું :- ૭૯, રાપે રેસીડેન્સી, મું. થાણ, રેલ્વે કાંટકની પાસે, જલ્લો - ૧૫, ગુજરાત - ૩૮૨૦૦૪. અને અહીં પાસે : હાઉસ નં. ૪૦, અચારજી મંદિરની ચાલ, જા.ઈ.બી. સ્ટેશન રોડની પાસે, ભરૂચ, ગુજરાત - ૩૮૨૦૦૧.</p> <p>અને અહીં પાસે : @ કુમીલ હાઉસકીપીંગ એજન્સી ૨૧, નવી સંપત્તિ, સિવિલ હોસ્પિટલ પાસે, સ્ટેશન રોડ, ભરૂચ, ગુજરાત - ૩૮૨૦૦૧.</p> <p>અને અહીં પાસે : પ્લોટ નં. ૭૭, રાપે રેસીડેન્સી, રાપે કિષ્ના રેસીડેન્સીની સામે, ચાવજ કોસીંગ એન્ડ રેલ્વે કાંટકની પાસે, ચાવજ બી નેશનલ હાઉસ નં. ૮ રોડ, મોજે ચાવજ, જલ્લો-ભરૂચ, ગુજરાત - ૩૮૨૦૦૧</p> <p>Loan Amount - Rs. 129,809/- LAN - SHLHBRUH00000181 NPA Date : 03-10-2025</p>	<p>બીન ખેતીલાયક જમીન પરનો પ્લોટ, મોજે - ચાવજ, ભરૂચ, જમીનોનો બ્લોક / રેવન્યુ સર્વે નં. ૧૬૦, રાપે રેસીડેન્સી થી જમીનનું પૈકી પ્</p>		

Editorial
Two faces

In the early hours of January 3, the Donald Trump administration did something no modern American government has openly attempted: it seized a sitting, foreign head of state and flew him to New York to face federal prosecution. The Venezuelan leader, Nicolás Maduro, long indicted in the United States of America on narcotics and related charges, was captured during a US military operation in Caracas and transferred to American custody. The US administration portrayed the raid as a dramatic escalation of its 'war on drugs' campaign and a shortcut around the slow grind of sanctions and diplomacy. The operation immediately scrambled the geopolitics of the Americas and reignited a debate at home about whether the US can, or should, use military force to address what is ultimately a political problem under the banner of law enforcement. The American Right's fixation on Venezuela and on Maduro long predates this dramatic arrest. For decades, conservative politicians and commentators have used Venezuela as a shorthand for what they describe as the failures of 'socialism' and as a threat to Western security. Maduro's regime has been portrayed not merely as an authoritarian outlier but as evidence of systemic danger to the southern flank of the US. Figures such as then Senator Marco Rubio, now the US secretary of state, and allied conservative media voices have cast the Venezuelan government as both a narco-terrorist network and a proxy for the US's adversaries, arguing that Maduro's removal is necessary to stop drugs as well as defend hemispheric security and counter foreign influence. Drawing on Cold War tropes and the 'troika of tyranny' framing, this narrative has turned Venezuela into a political symbol in domestic culture wars rather than a subject of nuanced foreign policy debate. President Trump has framed the seizure in similarly expansive terms. In televised remarks, he suggested that the US would temporarily "run" Venezuela during transition and repeatedly gestured toward oil, speaking about "getting the oil flowing" and conversations with US companies eager to re-enter Venezuela. That emphasis has made it easier for critics to argue that the drug case functions as much as a justification as a motive. Maduro's first American stop is not a courtroom but a jail. He is being held at the Metropolitan Detention Center in Brooklyn, a facility notorious for dysfunction and harsh conditions. The facility is also familiar on account of other high-profile federal cases, such as those involving the singers, R. Kelly and Sean 'Diddy' Combs, the infamous narco-trafficker, Joaquín 'El Chapo' Guzmán, the Jeffrey Epstein confidant, Ghislaine Maxwell, and Trump's former lawyer, Michael Cohen.

Gujarat law college's negligence leaves 100 students without law certificates

Ahmedbad, More than 100 law graduates in Gujarat are facing an uncertain future after a private law college in Babra Taluka of Amreli district failed to pay mandatory inspection affiliation fees to the Bar Council of India. This has resulted in non-recognition of the institution and denial of certificates to students even though they have cleared the required All India Bar Council Exam (AIBE), conducted by the council every year.

According to rules laid down by the Bar Council of India (BCI), candidates must pass the AIBE to obtain a certificate (sanad) to practice law. However, only students graduating from colleges recognised by the Bar Council

are eligible to appear for the examination and receive the final certificate. As per reports, these students of a Babra college who had completed their LLB degree in 2023 and 2024 are unable to obtain their certificates and cannot practice, despite several of them having cleared the AIBE. Some students were allowed to appear for the examination last year following an interim court order, under which the council was permitted to fill out the sanad examination form and issue a provisional enrolment number. Around 70 students cleared the exam, but their certificates have been withheld as the college has failed to clear its pending dues with the council.

Budget 2026 - Boosting India's Global Competitiveness



Dr. Vinod Chandrashekhar Dixit
Free-lance Journalist, Writer & Cartoonist
(dixitpatrakar@yahoo.in)

The Union Budget 2026, presented by Finance Minister Nirmala Sitharaman, highlights India's fiscal journey with sustained policy continuity and a clear economic vision. In her ninth consecutive Union Budget, Finance Minister Nirmala

Sitharaman emphasized India's need to stay integrated with global markets, boost exports, and attract long-term investments. It showcases resilience, structural reforms, and measured responses to global and domestic challenges, signalling a steady approach to long-term growth and fiscal governance. India's economy is growing at 6.8-7.2% annually despite global uncertainty. As India moves steadily toward its Viksit Bharat vision, the Union Budget 2026 becomes a critical opportunity to accelerate the country's next wave of economic transformation. The Union Budget 2026 aims to sustain growth, balance fiscal discipline, and promote inclusive development. Key expectations include middle-class tax relief, infrastructure-driven growth, and employment generation. The Union Budget 2026 brings

exciting benefits for the common man, focusing on inclusive growth, job creation, and improved infrastructure. Key highlights include tax relief through simplified rules and forms, making compliance easier. Healthcare gets a boost with plans to create 1 lakh allied health professionals and train 1.5 lakh caregivers over five years. Education is prioritized with initiatives like one girls' hostel in every district for STEM institutions and a new National Institute of Design in eastern India.

The Union Budget 2026 includes several key announcements. Odisha will get its first national waterway, connecting Talcher, Angul, and Kalinga Nagar to Paradip and Dhamra ports. Kerala is set to benefit from turtle trails for conservation-based tourism and local jobs, a Coconut Promotion Scheme, and support for cashew and cocoa production. Additionally, the

budget announces an East Coast Industrial Corridor connecting Durgapur (West Bengal) and a new freight corridor linking Dankuni (West Bengal) to Surat (Gujarat). The emphasis on tourism, care services, bio-pharma, textiles, etc., is indicative of India's growth ambitions being powered by the services sector. There appears to be a strong focus on demand-linked training and sector-specific skilling. It is also proposed the constitution of a high-level committee to comprehensively review the banking sector and align it with the country's next phase of growth. The Union Budget 2026 acknowledges the need to create jobs for youths, focusing on training caregivers and boosting services exports to 10% by 2047. Seven high-speed rail corridors will be developed as 'growth

connectors'. Infrastructure spending prioritizes Railways and roads, accounting for over half of the Centre's capital expenditure. The 16th Finance Commission's recommendations are accepted, retaining states' share in tax revenues at 41% for the next five years. Sitharaman rightly said that "There are honest taxpayers who are willing to settle disputes by paying all their dues. But they get deterred due to negative connotation associated with penalty. They will now be able close cases by paying an additional amount in lieu of penalty. Experts believe this budget prioritizes growth continuity, tax certainty, and sector-led investment, aligning with India's vision of becoming a developed nation by 2047.

The budget also emphasizes rural prosperity,

with the Bharat-VISTAAR platform guiding farmers on crops, weather, and markets. Seven high-speed rail corridors will cut travel time and boost regional economies. MSMEs receive support through a ₹10,000 crore SME Growth Fund and ₹7 lakh crore via TREDIS to ease liquidity stress. The Union Budget 2026 reflects a mature and confident approach, prioritizing long-term competitiveness and structural reforms over short-term gains. It aims to drive resilient growth, global integration, and a predictable regulatory environment, positioning India for sustained success amidst global uncertainty. Overall, the budget aims to improve daily life, increase incomes, and drive economic growth. (B-15 Jyoti-Kalash Society, Jodhpur Tekra, Satellite, Ahmedabad - 380 015)

8679 candidates qualified in PSI recruitment

Gandhinagar, An important announcement has been made regarding the Unarmed Police Sub Inspector (PSI) Recruitment 2024-25 announced by the Gujarat Police Recruitment Board. After the completion of both the exams, the list of 8679 qualified

candidates has been announced. Out of which 1023 candidates will be called for document verification from February 5. The call letters for which can be downloaded from February 2. Gujarat Police Recruitment Board has made an important announcement

regarding Unarmed Police Sub Inspector (PSI) Recruitment 2024-25. In this recruitment process conducted under recruitment notification number GPRB/202324/1, a written examination was conducted for the candidates who qualified in the physical test.

ASHOKA METCAST LIMITED
CIN: L70101GJ2009PLC057642
Regd. Office : 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Roads, Ahmedabad - 380006, Gujarat, India
Tel. No. 079 26463226, Email ID : info@ashokametcast.in, Website : www.ashokametcast.in

NOTICE OF POSTAL BALLOT & E-VOTING INFORMATION
Notice is hereby given pursuant to the provisions of Sections 108 and 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended ("the Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, as amended ("the Management Rules"), General Circular No. 03/2025 dated September 22, 2025, 09/2024 dated September 19, 2024, 17/2020 dated April 13, 2020 and 14/2020 dated April 08, 2020 issued by the Ministry of Corporate Affairs, Government of India (hereinafter collectively referred to as "the MCA Circulars"), Secretarial Standards on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2") and any other applicable laws, rules, circulars, notifications and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), approval of members of the Company is sought for the following special resolutions as set out in the notice of Postal Ballot by voting through electronic means only ("remote E-voting").

Sr. No.	Description of Resolution
1.	Regularization of Appointment of Mr. Kunjan Nathabhajai Rathod (DIN: 10964701) as a Non-Executive Independent Director of the Company
2.	Alteration (Addition) in object clause of the Memorandum of Association of the Company

The Company has sent Postal Ballot Notice along with the Explanatory Statement on 2nd February, 2026, by email to only those members who have registered their email addresses with the Company/ RTA/ depository/ depository participants and whose names appear in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, 30th January, 2026. Members may note that the Notice is also available on Company's website at www.ashokametcast.in, website of BSE at www.bseindia.com, website of NSE at www.nseindia.com and website of CDSL at www.evotingindia.com. The physical copy of the Notice along with explanatory statement, Postal Ballot Form and pre-paid business reply envelope (BRE) has not been sent for this postal ballot in due compliance of MCA circulars.

The Remote e-voting period shall commence on **Tuesday, 3rd February, 2026 (9:00 A.M. IST)** and end on **Wednesday, 4th March, 2026 (5:00 P.M. IST)** (both days inclusive). During these period shareholders' of the Company, holding shares as on the cut-off date (record date) of **Friday, 30th January, 2026** may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter.

Members are requested to refer to the detailed instructions for E-voting mentioned in notes forming part of the Postal Ballot Notice. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL,) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free no. 1800 21 09911.

Mr. Chintan K. Patel, Practicing Company Secretary, Ahmedabad is appointed as the Scrutinizer for conducting the Postal Ballot through remote e-voting process in a fair and transparent manner.

The result of the Postal Ballot shall be declared by the Chairman or any other duly authorized person of the Company on or before Friday, 6th March, 2026, the same shall be communicated to the Stock Exchanges and would also be uploaded on the Company's website at www.ashokametcast.in.

Members who have not registered their e-mail address so far, or want to change their email ids, are requested to register/change the same with their Depository Participants, so as to receive all communications electronically.

For, Ashoka Metcast Limited
By order of Board
Sd/-
Ashok C. Shah
Managing Director, DIN: 02467830

Place : Ahmedabad
Date : 2nd February, 2026

ARMAN HOLDINGS LIMITED
CIN : L65993GJ1982PLC082961
Registered Office : Office No.106, Sanskruti AC Market, Parvat Godadara BRTS Road, Parvat Patia, Surat - 391050.
Tel : 9586006569 Email ID : armanholdingsltd@gmail.com,
Website : www.armanholdings.in

Notice
Notice is hereby given that pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 and SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2nd July, 2025, a request has been received by the Company from Mrs Vijayalakshmi Jethmal Jain residing at A-603, Palm Spring, 6th Floor, 3rd TPS Road, Near Kora Kendra Ground Borivali (West), Mumbai - 400092 to transfer the below mentioned securities held in the name(s) of the security holder(s) as detailed below, to his name. These securities were claimed to have been purchased by him and could not be transferred in his favour.

Folio No.	Name(s) of the Holder(s) and registered address	Security Type / Face Value	No. of Securities	Distinctive No. From - To
227A	Murjez Franklin- New Delhi - 110019	Equity Rs. 10/-	200	99601- 99650 110101- 110250
228A	I B Prakash - New Delhi - 110061	Equity Rs. 10/-	100	105851-105950
228	Nareesh Arora - New Delhi - 110061	Equity Rs. 10/-	100	105751-105850
232	G K Mittal - -- New Delhi - 110019	Equity Rs. 10/-	250	142751-143000 17701 - 19700 43701-48200
279	Nikhil Jain - Mumbai- 400101	Equity Rs. 10/-	6500	152751-153000 153251-153750 180151-180450 180751-181100 182301-182700 187151-187600 209401-209900 2114401-211900 215901-216400 152001-152250 201901-202400 194401-194900 195401-195900 199901-200400 91501-95500
283	Manju Jain - Ajmer 305001	Equity Rs. 10/-	6000	205401-205900 115401- 116400
265	Deepesh Jain - Ajmer 305001	Equity Rs. 10/-	4500	10701-13700 182701-183100 200401-200900 201401-201900 209901 - 210400 210901 - 211400 211901 - 212400 212901- 213400 214401 - 214900 216401 - 217900 229501 - 232500 214901 - 215900
269	Amit Jain - Mumbai 400004	Equity Rs. 10/-	1000	81001 - 91500 123601 - 123800 111201 - 111400 112201 - 112400 206401 - 206900 223501 - 224500
281	Mukesh Kumar Jain - Bhiwara Mrugesh Natwarlal Ruparel - Ahmedabad - 380001	Equity Rs. 10/-	5000	401- 5400
V000004		Equity Rs. 10/-	250	99501-99550 22701-27700 10401-10700 1- 300
280	Lokesh Kumar Kabhya - Bhiwara	Equity Rs. 10/-	5900	178351-178650
282	Rakesh Jain - Bhiwara	Equity Rs. 10/-	5000	5401-10400
V000002	Vijay Kumar Lodha - Ajmer	Equity Rs. 10/-	12400	
A000004	Ankit Jain - Ajmer	Equity Rs. 10/-	12600	

Any person who has a claim in respect of the above mentioned securities should lodge such claim with the Company at its Registered Office within 30 days from this date along with appropriate documentary evidence thereof in support of such claim, else the Company will proceed to transfer the securities in favour of Mrs Vijayalakshmi Jethmal Jain without any further intimation.

For Arman Holdings Limited
Sd/-
Drishi Singh
Company Secretary & Compliance

Place: Surat
Date: 02-02-2026

IDFC FIRST Bank Q3 FY26 PAT at Rs. 503 crores



Ahmedabad, The Board of Directors of IDFC FIRST Bank, in its meeting held today, approved the unaudited financial results for the quarter and nine months ended December 31, 2025. 89% of the YoY growth in loans and advances of the Bank is constituted by growth in Mortgage Loans, Vehicle loans, Consumer loans, Business Banking and Wholesale loans. Credit Cards in force reached 4.3 million during Q3 FY26. Wealth management Business of the Bank grew by 31% YoY to reach Rs. 58,957 crores. Provisions for the Quarter

reduced by 3.7% QoQ from Rs. 1,452 crores to Rs. 1,398 crores. Commenting on the results, Mr. V Vaidyanathan, MD and CEO said "We are seeing a strong business momentum across all our main lines of businesses, including lending, deposits, wealth management, transaction banking etc. Our asset quality has improved with GNPA at 1.69% and Net NPA at 0.53% as of 31st December 2025. On cost of funds, we expect it to further drop from here because of recent revision in savings rates, which will enable us to expand our lending franchise." (19-10)

SURYODAY
A MEMBER OF SURYODAY FINANCE GROUP

Suryoday Small Finance Bank Limited
Regd. & Corp. office : 1101, Sharda Terraces, Plot 65, Sector - 11, CBD Belapur, Navi Mumbai - 400614. CIN: L65923MH2008PLC261472.

POSSESSION NOTICE
Whereas The undersigned being the Authorized Officer of the M/s. Suryoday Small Finance Bank Ltd., under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (ACT NO.54 OF 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice to below mentioned Borrower/s / Guarantor/s. After completion of 60 days from date of receipt of the said notice, The Borrower/s / Guarantor/s having failed to repay the amount, notice is hereby given to the Borrower/s / Guarantor/s and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on them under section 13(4) of the said Act read with Rule 6 & 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on the date mentioned herewith:

Name of Borrower/Co-Borrower/Guarantor	Date of Demand Notice	Total Outstanding Amount in Rs.	Date of Possession
207000000050 & 207000000051. 1) MR. MANOHARE KAMLAKAR DILIPBHAI S/O DILIPBHAI 2) MRS. MANOHARE MANISHA KAMLAKAR W/O KAMLAKAR PANCHALKAR	11.09.2025	Rs. 16,69,557.37/- as on 10.09.2025	30-Jan-26 (Symbolic)

Description Of Secured Asset(S) /Immovable Property (ies): All That Piece And Parcel Of Immovable Property Being Flat No.404, In Block No.2 Of Sector-A (I.E. Flat No.2/A/404) On Fourth Floor, Having Area Admeasuring 115 Sq. Yds. I.E. 96.12 Sq.Mtrs. (Super Built-Up) Alongwith Undivided Share In Land Adme. 9.25 Sq.Mtrs. In The Scheme Known As 'Svaminarayan Park (Naroda)' Situated At Final Plot No.22-44/2 Of Draft Town Planning Scheme No.121 Allotted In Lieu Of Survey No.610 & 632 Paiki Of Mouje Naroda Taluka Asarva In The District Of Ahmedabad & Registration Sub District Of Ahmedabad-6 (Naroda) Within The State Of Gujarat, The Said Property Is Bounded As Under -I/va East: Society Internal Road, West: Sector-A, Block No.2, Flat No.401, North: Sector-A, Block No.2, Flat No.403, South: Sector-A, Block No.1, Flat No.403

The Borrower/s / Guarantor/s in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the M/s Suryoday Small Finance Bank Ltd, for an above mentioned demanded amount and further interest thereon.

Authorised Officer
Place : Ahmedabad, Date : 03.02.2026
Suryoday Small Finance Bank Limited

Truhome
FINANCE

TRUHOME FINANCE LIMITED
(Formerly Known As Shriram Housing Finance Limited)
Reg.Off.: Srinivasa Tower, 1st Floor, Door No. 5, Old No.11,2nd Lane, Cenatopha Road, Alwarpet, Teynampet, Chennai-600018
Head Office: Level 3, Wockhardt Towers, East Wing C-2 Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai-400051 Website: www.truhomefinance.in

DEMAND NOTICE
Notice is hereby given that the following borrower/s have defaulted in the repayment of principal & interest of the loan facilities obtained by them from the Truhome Finance Limited (formerly Shriram Housing Finance Limited) and the said loan accounts have been classified as Non-performing Assets (NPA). The Demand Notice was issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI ACT) on their last known address. In addition to the said demand notice, they have been informed by way of this public notice.
Details of Borrowers, Securities, Outstanding dues, Demand Notices sent under section 13(2) and the amount claimed there under given as under:-

Borrower/Co-Borrower/ Name & Address	Property Address of Secured Assets	Demand Notice Date & Amount Due in Rs.
LAN Number - SHLHVDDR0000835 & SHLHVDDR0000834 1. Chawlia Paramjeetsingh S (Borrower No.1) And 2. Veena Chawlia (Borrower No.2) All Residing at - 2A/306-Parmeshwar Apartment, Nr. Essar Petrol Pump, Tarsali Vadodara, Gujarat -390009 Also AT:-Gurunanak Dept. Store Shop No.S 1-8, Nandanavan Complex, Suren Ring Road Tarsali, Vadodara, Gujarat-390009 Also AT:-Flat No.E-102, & Flat No.E-103, 1st Floor Tower E, Malbar Valley. Opp. Pushpak Skyline, Beside Shantam, Tarsali, Vadodara, Gujarat-390009. Nr.Uma Vidhyalaya Road, Tarsali, Vadodara, Gujarat-390009. Loan Amount - Rs. 16.77,287/- LAN - SHLHVDDR0000835 NPA Date - 03-10-2025 Loan Amount - Rs. 17.97,875/- LAN - SHLHVDDR0000834 NPA Date - 03-10-2025	Property No.1: Non-agricultural plot of land in Mouje Tarsali, Vadodara lying being land bearing R.S.No.42/2 admeasuring 10825 Sq.Mtrs., T.P.Scheme no. 38, F.P.No. 25/2 admeasuring 3838.00 Sq. Mtrs., Known as "MALBAR VALLEY" Tower E, First Floor, Flat No.102 Carpet Area admeasuring 47.39 Sq. Mtrs., Balcony Wash Area admeasuring 4.80 Sq.Mtrs., Total Carpet Area admeasuring 52.19 Sq.Mtrs., Undivided Share of land admeasuring 19.88 Sq.Mtrs., at Registration & Sub District Vadodara , District Vadodara within the State of Gujarat. Boundaries of the property:- North : By 18.00 Mtrs.,T.P.Road, South : By Flat No.E-101, East: By Flat No.E-103, West: By 18. Mtrs.,T.P.Road, Property No.2: Non-agricultural plot of land in Mouje Tarsali, Vadodara lying being land bearing R.S.No.42/2 admeasuring 10825 Sq.Mtrs., T.P.Scheme no. 38, F.P.No. 25/2 admeasuring 3838.00 Sq. Mtrs., Known as "MALBAR VALLEY" Tower E, First Floor, Flat No.103 Carpet Area admeasuring 44.35 Sq. Mtrs., Balcony Wash Area admeasuring 3.47 Sq. Mtrs., Total Carpet Area admeasuring 47.82 Sq.Mtrs., Undivided Share of land admeasuring 18.44 Sq.Mtrs., Super Built Up Area admeasuring 91.03 Sq.Mtrs., i.e. 979.50 Sq.Fts. at Registration & Sub District Vadodara , District Vadodara within the State of Gujarat. Boundaries of the property:- North : By 18.00 Mtrs., Road South : By Flat No.E-104, East : By Society Road, West :By Flat No.E-102,	Demand Notice Date - 28/01/2026 Demand notice Amount- Rs. 18,03,974/- (Rupees Eighteen Lakh Three Thousand Nine Hundred Seventy Four only) as on 21/01/2026 under reference of loan account no. SHLHVDDR0000835 & Rs. 19,27,827/- (Rupees Nineteen Lakh Twenty Seven Thousand Eight Hundred Twenty Seven only) as on 21/01/2026 under reference of loan account no. SHLHVDDR0000834 along with further interest as mentioned hitherto and incidental expenses, costs etc.
LAN Number - SHLHBRUH0000181 1. VASAVA HANSABEN RAHULKUMAR (Borrower No.1) And 2. VASAVA RAHULKUMAR SOMABHAI (Borrower No.2) All Residing at - 79, Radhe Residency,At-Chavai N.R.Railway fatak, Dist.Bharuch, Gujarat- 392001 Also AT:-House No.40, Acharji mandir ni chal N.R.G.E.B.Station Road, Bharuch, Gujarat-392001. Also AT:- @Dhruvil Housekeeping Agency 21/ Navi Vasahat, Nr. Civil Hospital, Station Road, Bharuch, Gujarat-392001. Also AT:- Plot No.77, Radhe residency, Opp.Radhe Krishna Residency Nr. Chavaj Crossing & Railway fatak, Chavaj to N.H.No.8 Road Moje Chavaj, Dist.Bharuch, Gujarat-392001. Loan Amount - Rs. 12.89,209/- LAN - SHLHBRUH0000181 NPA Date - 03-10-2025	Non agricultural plot of land in Moje Chavaj, Bharuch lying being land bearing Block / Revenue Survey No. 160, Known as "RADHE RESIDENCY" Paikhi Plot no. 77, Adm Area 67.25 Sq Mtrs, Undivided Share of Land admeasuring 16.81 Sq. Mtrs, Construction Ground Floor:37.84 Sq Mtrs And First Floor:36.72 Sq Mtrs, Total Construction Area 74.56 Sq Mtrs., at Registration District & Sub District Bharuch District Bharuch within the State of Gujarat. Boundaries of the property:- East:- By Plot No.78 West:- By Plot No.76 North:- By Plot No.72 South:- By Society Internal Road	Demand Notice Date - 28/01/2026 Demand notice Amount- Rs. 14,11,815/- (Rupees Fourteen Lakh Eleven Thousand Eight Hundred Fifteen only) as on 21/01/2026 under reference of loan account no. SHLHBRUH0000181 along with further interest as mentioned hitherto and incidental expenses, costs etc.

You the borrowers are therefore called upon to make the payment of the outstanding dues as mentioned hereinabove in full within 60 days from the date of receipt this notice, together with interest and penal interest till the date of realization of payment, which may fall due, failing which the undersigned shall be constrained to take action under the SARFAESI Act, to enforce the abovementioned securities. Please note that as per Sec 13(13) of the said act, you are restrained from transferring the above referred securities by way of sale, lease, or otherwise without our consent.

Place: Bharuch, Vadodara
Date: 03-02-2026

Sd/- Authorised Officer- Truhome Finance Limited
(Earlier Known as Shriram Housing Finance Limited)